



RAN-2401000105020563

T.Y.B.A. (Sem. - V) Examination November - 2025
Economics (Paper -13) International Economics

Time: 2 Hours]

[Total Marks: 50

સૂચના : / Instructions

- (1) ઉપરોક્ત દર્શાવેલ વિગતો ઉત્તરવહી પર અવશ્ય લખવી.
Fill up strictly the above details on your answer book.
- (2) પ્રશ્ન નંબર ૧ ફરજિયાત છે.
First Question is Compulsory.
- (3) જમણી બાજુના અંક પ્રશ્નનો પૂરા ગુણ દર્શાવે છે.
Figures to the right indicate full marks.

Seat No.:

--	--	--	--	--	--

Student's Signature

- પ્ર.1. નીચેના પ્રશ્નોનાં ટૂંક માં જવાબો આપો. (ગમે તે પાંચ) (10)**
- (1) આંતરરાષ્ટ્રીય વેપાર ઉદભવવાના કારણો જણાવો.
 - (2) વૈકલ્પિક ખર્ચનો અર્થ લખો.
 - (3) હેક્ષર ઓહલીનના આંતરરાષ્ટ્રીય વેપારના સિદ્ધાંતની ચાર મર્યાદા જણાવો.
 - (4) વેપારની શરતો એટલે શું ?
 - (5) મુક્ત વેપાર એટલે શું ?
 - (6) નિવેદ રેખાઓનો અર્થ આપો.
 - (7) સંરક્ષણાત્મક જકાત અને આવક જકાત એટલે શું ?
- પ્ર.2. “આંતરરાષ્ટ્રીય વ્યાપારએ આંતરિક વ્યાપારનું જ એક વિશિષ્ટ સ્વરૂપ છે” તે સમજાવી બન્ને વ્યાપાર વચ્ચેના તફાવતના મુદ્દાઓ ચર્ચો. (13)**
- અથવા**
- પ્ર.2. (અ) આંતરરાષ્ટ્રીય વેપારના તુલનાત્મક ખર્ચ તફાવતનાં સિદ્ધાંત ની ધારણાઓ જણાવો. (07)**
- (બ) આંતરરાષ્ટ્રીય વેપારના વૈકલ્પિક ખર્ચ ના સિદ્ધાંત ની મર્યાદાઓ જણાવો. (06)**
- પ્ર.3. આંતરરાષ્ટ્રીય વેપારના લાભો જણાવી આંતરરાષ્ટ્રીય વેપારના લાભને અસર કરતાં પરિબળો અને તેને મહત્તમ બનાવવાની શરતો સમજાવો. (13)**
- અથવા**
- પ્ર.3. (અ) મુક્ત વ્યાપારનીતિના લાભ જણાવો. (07)**
- (બ) આયાત જકાત અને આયાત પરિમાણની તુલનાત્મક ચર્ચા કરો. (06)**
- પ્ર.4. ટૂંકનોંધ લખો. (ગમે તે બે) (14)**
- (1) ઉત્પાદન શક્યતા રેખા.
 - (2) સાધન વિપુલતા.
 - (3) વેપારની શરતોનાં પ્રકારો.
 - (4) સંરક્ષણ નીતિની તરફેણની દલીલો.

ENGLISH VERSION

- Q.1. Answer the following questions briefly (Any Five) (10)**
- (1) State the reasons for emergence of International Trade.
 - (2) Write the meaning of opportunity cost.
 - (3) State four limitations of Hecher-Ohlins theory of international trade.
 - (4) What are terms of Trade?
 - (5) What is Free Trade?
 - (6) Give the meaning of **Offer Curve**.
 - (7) What is protection tariff and income tariff?
- Q.2. “International trade is a special case of Inter regional trade” Explain it and discuss the difference between two of them. (13)**
- OR**
- Q.2. (A) State the assumptions of Comparative Cost Advantage Theory of International Trade. (07)**
(B) State the limitations of Opportunity Cost Theory of International Trade. (06)
- Q.3. State the advantages of international trade. Explain the factors affecting advantages of international trade and conditions to make it maximum. (13)**
- OR**
- Q.3. (A) State the benefits of free trade policy. (07)**
(B) Discuss the Import tariff and Import quota comparatively. (06)
- Q.4. Write a short note (Any Two) (14)**
- (1) Production Possibility Curve.
 - (2) Factor abundance.
 - (3) Types of Terms of Trade.
 - (4) Favorable argument of Protection policy.
-